



પ્રેસનોટ

તા. ૧૩.૦૨.૨૦૧૯

આજરોજ “શ્રી કમલમ્” ખાતે પ્રદેશ યુવા મોરચાની બેઠક યોજાઈ.

તારીખ ૨૭ માર્ચે રાજ્યભરમાં વિધાનસભાદિઠ યોજનાર બાઈક રેલીમાં
ભાજપા યુવા મોરચાના ૫ લાખથી વધુ યુવાનો જોડાશે

તારીખ ૧૪, ૧૫, ૧૬ ફેબ્રુઆરીના રોજ ભારત કે મન કી બાત”- મોદી કે સાથઅભિયાન “ અંતર્ગત ૫૮૦
સ્થાનો પર વિવિધ ક્ષેત્રના યુવાનોના અભિપ્રાયો મેળવવા યુવા મોરચો જોડાશે

“મેરા પરિવાર-ભાજપા પરિવાર” અભિયાન અંતર્ગત તારીખ ૧૪ અને ૧૫, ફેબ્રુઆરીના રોજ ગુજરાતભરમાં
યુવા મોરચાના કાર્યકર્તાઓ પોતાના નિવાસસ્થાને ભાજપાના ધ્વજનું ધ્વજરોહણ કરશે.

તારીખ ૧૯ થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન યુવા મોરચા દ્વારા મંડલ થી લઈને જીલ્લા સ્તર સુધી રમતોત્સવ તથા
યુવા મહોત્સવ યોજાશે

તારીખ ૨૪ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે પ્રદેશકક્ષાના યુવા મહોત્સવ તથા રમતોત્સવ યોજાશે

ભાજપા પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડો. ઋત્વિજ પટેલે “શ્રી કમલમ્” ખાતે ઈલેક્ટ્રોનિક મીડિયાને
સંબોધતા જણાવ્યું હતું કે, આજરોજ પ્રદેશ યુવા મોરચાની પ્રદેશ બેઠક મળી હતી, જેમાં પ્રદેશ મહામંત્રી અને
યુવા મોરચાના પ્રભારી શ્રી કે.સી.પટેલ, પ્રદેશ મંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

શ્રી પટેલે જણાવ્યું હતું કે, ભારત કે મન કી બાત”- મોદી કે સાથઅભિયાન “ અંતર્ગત તારીખ ૧૪, ૧૫,
૧૬ ફેબ્રુઆરીના રોજ યુવા મોરચો ભાજપાના સંકલ્પપત્ર માટે ફરતા રથ સાથે જોડાઈ ગુજરાતભરમાં ૫૮૦
સ્થાનો પર પરિભ્રમણ કરી કોલેજીયન યુવાનો, નોકરીયાત યુવાન, ખેડુત યુવાન, ઈલોગક્ષેત્રે જોડાયેલ યુવાન આ
તમામ યુવાનોના સંપર્ક કરી તેમનો અભિપ્રાય મેળવશે.

ભારતીય જનતા પાર્ટી

ગુજરાત પ્રદેશ

શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

..૨..

રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમિતભાઈ શાહના વરદ્ હસ્તે શરૂ થયેલ “મેરા પરિવાર-ભાજપા પરિવાર” અભિયાનમાં સહભાગી થઈને તારીખ ૧૪ અને ૧૫, ફેબ્રુઆરીના રોજ ગુજરાતભરમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ પોતાના નિવાસસ્થાને ભાજપાના ધ્વજનું ધ્વજરોહણ કરશે.

પ્રદેશ ભાજપા યુવા મોરચા દ્વારા મંડલ થી લઈને જીલ્લા સ્તર સુધી તારીખ ૧૯ થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન રમતોત્સવ તથા યુવા મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવશે. આ રમતોત્સવમાં મંડલસ્તરે ચેસ, કબડી, કેરમ, વોલીબોલ અને રસ્સા ખેંચ જેવી સ્પર્ધાત્મક રમતો યોજાશે. મંડલસ્તરેથી વિજેતા થયેલ ટીમ જીલ્લાસ્તરે ભાગ લેશે અને ત્યારબાદ જીલ્લાસ્તરે વિજેતા થયેલ ટીમ તારીખ ૨૪ ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે યોજનાર પ્રદેશ કક્ષાના રમતોત્સવમાં ભાગ લેશે.

તે જ પ્રકારે તારીખ ૨૧ અને ૨૨ ફેબ્રુઆરીના રોજ મંડલ થી લઈ જીલ્લાકક્ષાએ યુવા મહોત્સવનું આયોજન હાથ ધરાશે. આ યુવા મહોત્સવમાં દેશભક્તિ વેશભુષા કાર્યક્રમ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજના આધારિત નાટકો, સંગીત-નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી યુવાનોની પ્રતિમાને બહાર લાવવાના હેતુથી સ્પર્ધાત્મક કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ તારીખ ૨૪ ફેબ્રુઆરીના રોજ જીલ્લાસ્તરે સારું પર્ફોમન્સ કરનારને ગાંધીનગર ખાતે યોજનાર પ્રદેશકક્ષાના યુવા મહોત્સવમાં ભાગ લેવાનો અવસર મળશે.

તારીખ ૨૭ માર્ચના રોજ રાજ્યભરમાં યોજનારમાં વિધાનસભાદીઠ બાઈક રેલી યોજનાર છે, જેમાં યુવા મોરચાના પાંચ લાખથી વધુ યોવાનો ભાગ લેશે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ બેઠકમાં પ્રદેશ યુવા મોરચાની ટીમ, રાષ્ટ્રીય યુવા મોરચાના પદાધિકારીઓ, જીલ્લા મહાનગરના પ્રભારી-સહપ્રભારી, જીલ્લા/મહાનગરોના યુવા મોરચાના પ્રમુખ/મહામંત્રીશ્રીઓ તથા બાઈક રેલીના ઈન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા તેમ શ્રી પટેલે અંતમાં જણાવ્યું હતું.

(ડૉ. હર્ષદ પટેલ)

પ્રદેશ કન્વીનર, મીડીયા વિભાગ

ભારતીય જનતા પાર્ટી

ગુજરાત પ્રદેશ

શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

પ્રેસનોટ-૦૨

તા. ૧૩.૦૨.૨૦૧૯

આજરોજ વલસાડ જિલ્લાના ધરમપુર મુકામે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હોલ ખાતે અને તાપી રીવરફ્રન્ટ, સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડણજીશી અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા તથા પ્રદેશ અગ્રણીશ્રીઓની ઉપસ્થિતિમાં વલસાડ, નવસારી અને સુરત લોકસભા બેઠકોનું ક્લસ્ટર સંમેલનો યોજાયા હતા.

જેમાં લોકસભા મતવિસ્તારના લોકસભા સીટના પ્રભારી, ઈન્ચાર્જ-સહઈન્ચાર્જશ્રીઓ, લોકસભા સીટના વિસ્તારકો, સંકલન સમિતિના સભ્યશ્રીઓ, પ્રદેશ પદાધિકારીશ્રીઓ, પ્રદેશ કારોબારી સભ્યશ્રીઓ, મંડલ પદાધિકારી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડેલા ઉમેદવારશ્રીઓ, પ્રદેશ અને જિલ્લા/ મહાનગરના મોરચા પદાધિકારીશ્રીઓ, મંડલ મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, શક્તિકેન્દ્રના ઈન્ચાર્જ-પ્રભારીશ્રીઓ, બોર્ડ-નિગમના પદાધિકારીઓ તથા પૂર્વ સાંસદ-ધારાસભ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(ડૉ. હર્ષદ પટેલ)

પ્રદેશ કન્વીનર, મીડીયા વિભાગ